



Atul Ltd

Atul 396 020, Gujarat, India
legal@atul.co.in | www.atul.co.in
(+91 2632) 230000

May 28, 2024

The Manager
Listing Department
BSE Limited
Phiroze Jeejeebhoy Towers
Dalal Street
Mumbai – 400 001
Through: BSE Listing portal
SCRIP CODE: 500027

The Manager
Listing Department
National Stock Exchange of India Limited
“Exchange Plaza” C – 1, Block G
Bandra Kurla Complex, Bandra (East)
Mumbai – 400 051
Through: Digital Exchange portal
SYMBOL: ATUL

Dear Sirs:

Sub: Letter to the shareholders in respect of transfer of equity shares of the Company to Investor Education and Protection Fund (IEPF)

Pursuant to regulation 30 read with Schedule 3 of the Securities and Exchange Board of India (Listing Obligation and Disclosure Requirements) Regulations, 2015, we wish to inform you that, pursuant to the provisions of Section 124(6) of the Companies Act, 2013 read with the Investor Education and Protection Fund Authority (Accounting, Auditing, Transfer and Refund) Rules, 2016, the Company has sent letter to the shareholders, who have not claimed | encashed their dividend for seven or more consecutive years.

A copy of the letter sent to shareholders and newspaper advertisement are attached herewith.

Kindly acknowledge the receipt and inform the members of the exchange.

Thank you,

Yours faithfully,

For Atul Limited

Lalit Patni
Company Secretary and
Chief Compliance Officer



ATUL LTD

Registered office: Atul House, G I Patel Marg, Ahmedabad 380 014, Gujarat, India

Telephone: (+91 79) 26461294 | 26463706

E-mail: shareholders@atul.co.in | Website: www.atul.co.in

CIN: L99999GJ1975PLC002859

Name of shareholder

Address

Name of joint holder(s)

Date : 23.05.2024

Ref. No :

Folio No. | DP –CLID :

Shares :

Dear Shareholder(s),

Sub: Transfer of shares in respect of which dividend has not been claimed for seven consecutive years or more to the Investor Education and Protection Fund

This is to inform you that the provisions of Section 124(6) of the Companies Act, 2013 and the Investor Education and Protection Fund Authority (Accounting, Auditing, Transfer and Refund) Rules, 2016, which have come into effect from September 07, 2016, stipulates that shares on which dividend has not been encashed or claimed for seven consecutive years or more, then such shares are to be transferred to the Investor Education and Protection Fund (IEPF), a Fund constituted by the Government of India under Section 125 of the Companies Act, 2013.

It has been noticed that you have not encashed the following dividend on equity shares held by you for last seven consecutive years:

Dividend for the year	Warrant No.	Amount (Rs.)

The unclaimed dividend(s) prior to the year(s) mentioned above may have already been transferred to the Investor Education and Protection Funds (IEPF), as required under Section 124(5) of the said Act.

To claim above unpaid dividend or in case you need any information | clarification, please write to or contact our RTA M/s. Link Intime India Pvt. Ltd., 5th Floor, 506 to 508, Amarnath Business Centre - 1 (ABC-1), Beside Gala Business Centre, Near St. Xavier's College Corner, Off C G Road, Ellisbridge, Ahmedabad – 380 006.
Tel No: 079-26465179, 26465186, 26465187, e-mail: iepf.shares@linkintime.co.in

Please provide 1) Name of the Company, 2) Folio No. or DP and Client ID, 3) Name of shareholder(s), 4) Contact No, 5) E-mail ID in all your communications.

Also provide duly filled ISR forms alongwith supporting KYC documents of the shareholder(s) as per the SEBI Circular No. SEBI/HO/MIRSD/ MIRSD_RTAMB/P/CIR/2021/655 dated November 03, 2021. You may download requisite forms from RTA website <https://web.linkintime.co.in/KYC-downloads.html>

You are requested to claim unpaid dividend on or before **25.08.2024** failing which the above said shares will be transferred to IEPF at appropriate date.

After the shares have been transferred to IEPF, you can claim the said shares from IEPF Authorities, by filing e-form No. IEPF-5, as prescribed under the said Rules.

Thank you,

Yours faithfully,
For Atul Ltd

Authorised Signatory
This is a computer generated letter & hence does not require signature.

LIC Life Insurance Corporation of India
Estate Department, Divisional Office, "Jeevan Prakash Building" Sector-11, Gandhinagar-382010.
Ph. 079 23236391 | E-mail : estate.gandhinagar@licindia.com

SHIFTING OF OFFICE PREMISES

This is to inform all concerned that our **BAYAD SSO** will be shifted to new premises at the below mentioned address w.e.f. **18/06/2024**

LIC OF INDIA, BAYAD SSO

1st Floor, 134,135,136,116,117,118, Shreejidada Complex, Nr. Market Yard, At & PO Bayad, Dist. Aravali-383325
Place: Gandhinagar, Date : 28/05/2024 Sd. Divisional Manager, Gandhinagar

LIC Life Insurance Corporation of India
Estate Department, Divisional Office, "Jeevan Prakash Building" Sector-11, Gandhinagar-382010.
Ph. 079 23236391 | E-mail : estate.gandhinagar@licindia.com

SHIFTING OF OFFICE PREMISES

This is to inform all concerned that our **AMBAJI SSO** will be shifted to new premises at the below mentioned address w.e.f. **18/06/2024**

LIC OF INDIA, AMBAJI SSO

1st Floor, Krishna complex, Opp Chaudhary Dharamshala, Khedbrahma Road, Ambaji-385110 (Dist:Banaskantha)
Place: Gandhinagar, Date : 28/05/2024 Sd. Divisional Manager, Gandhinagar

IRCON INTERNATIONAL LIMITED
NAV RATNA COMPANY
(A Govt. of India Undertaking)
Website: www.ircon.org, CIN - L48203DL18760009171

e-Procurement Notice (National Competitive Bidding)

e-Tender No.: IRCON/ELECT/P&E/DISPOSAL/Steel Drums/2924-25/737 Dated 27.05.2024
e-Tenders are invited from bidders meeting qualifying requirements for the following work:
Name of Work : Sale of Materials like 33KV and 11KV Steel Cable Drums at IRCON project site in Banihal-Sangaldan section, Khari, Dist- Ramban, Jammu & Kashmir under USBRL Project, ON AS IS WHERE IS BASIS.

Estimated cost of the work	₹ 1,62,74,060.15
Last Date & Time of e-Bid Submission	17.06.2024 upto 15.00 Hrs.

For further details, visit website <https://etenders.gov.in/eprocure/app>. Corrigendum, if any, would be hosted only on the website.
Addl. General Manager/Electrical,
IRCON Project Office, Villi-Krawah, Post-Banihal, Distt-Ramban-182146

IRCON INTERNATIONAL LIMITED
NAV RATNA COMPANY
(A Govt. of India Undertaking)
Website: www.ircon.org, CIN - L48203DL18760009171

e-tender Notice

e-Tender No.: IRCON/MECH/P&E/MAHSR-T2/TSLC/739 Dated 25.05.2024
e-Tender for and on behalf of IRCON INTERNATIONAL LIMITED is invited from bidders meeting qualifying requirements for the work of "Supply, Installation & Commissioning of 02 Nos. of Track Slab Laying Car for MAHSR-T2 Project, Surat, Gujarat."

Last Date & Time of e-Bid Submission	10.06.2024, 15:00 Hrs.
--------------------------------------	------------------------

For further details, visit website <https://etenders.gov.in/eprocure/app>. Corrigendum, if any, would be hosted only on the website. CGM/Mechanical, IRCON International Ltd., C-4, District Centre, Saket, New Delhi-110017

MANAPPURAM FINANCE LTD.
CIN : L65910KL1992PLC006623
Registered Office: W - 4/ 638A, Manappuram House, P.O. Valapad, Thrissur - 680 567, Kerala, India

GOLD AUCTION NOTICE

The pledges in specific and the public, in general, are hereby notified that public auction of the gold ornaments pledged in the below accounts is proposed to be conducted at the following branches on 17/06/2024 from 10.00 am onwards. We are auctioning gold ornaments defaulted customers who have failed to make payment of his/her loan amount despite being notified by registered letters. Unauctioned items shall be auctioned on any other days without further notice. Changes in venue or date (if any) will be displayed at auction centre and on website without any further notice.

List of pledges:-
BHARUCH, ANKLESWAR BHARUCH, 114640700029557, 9564, 9565, 114640730015952, 5953, 5976, 5977, BHARUCH STATION ROAD, 116020700025228, 5236, 5262, 116020730014518, AIE MATA ROAD, 117150700036350, MAHIDHARPURA, 117100700031627, 1628, 1651, 1653, 1664, 1665, 1672, 1678,

Persons wishing to participate in the above auction shall comply with the following:- Interested Bidders should submit Rs. 10,000/- as EMD (refundable to unsuccessful bidders) by way of Cash on the same day of auction. Bidders should carry valid ID card/PAN card. For more details please contact 8089292353.

Authorised Officer
For Manappuram Finance Ltd

Atul Ltd

Registered office: Atul House, G I Patel Marg, Ahmedabad 380 014, Gujarat, India
Corporate identity number: L99999GJ1975PLC002859
Telephone: (+91 79) 26461294 | 26463706
E-mail: shareholders@atul.co.in | Website: www.atul.co.in

NOTICE

Notice is hereby given that pursuant to the Rule 6 of the Investor Education and Protection Fund Authority (Accounting, Audit, Transfer and Refund) Rules, 2016, as amended from time to time, the Company has to transfer the equity shares in respect of which the dividend has not been claimed for seven or more consecutive years to the Investor Education and Protection Fund (IEPF).

In this regard, the Company has sent individual letter by Post on May 24, 2024 to the shareholders holding the above mentioned equity shares, at their address registered with the Company, advising them to claim the dividend on or before August 25, 2024. The details are available at www.atul.co.in

Please note that after August 25, 2024, the Company will transfer the equity shares to the IEPF account and thereafter the shares can be claimed from the IEPF Authority.

For further clarification, if any, you may please e-mail | write at the above address.

Lalit Patri
Atul
May 27, 2024
Company Secretary and
Chief Compliance Officer

